



DCP-19080001020803 Seat No. _____

B. Com. (Sem. II) (CBCS) (W.E.F. 2019) Examination

July - 2022

Banking & Finance
(Banking & Finance-2)
(New Course)

Time : $2\frac{1}{2}$ Hours]

[Total Marks : 70

- સૂચના : (1) જવાબ સ્પષ્ટ અને મુદ્દાસર લખો.
(2) જમણી બાજુનાં અંક ગુણ દર્શાવે છે.

- 1 આધુનિક યુગમાં બેંકિંગ ટેકનોલોજીની જરૂરિયાતની ચર્ચા કરી તેનું મહત્વ સમજાવો. 20

અથવા

સલામત ધિરાણના માર્ગદર્શન સિદ્ધાંતો વિસ્તૃત રીતે વર્ણવો.

- 2 નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટનો અર્થ, લક્ષણોની સમજૂતી આપો. 20

અથવા

(અ) કોર્સિંગના પ્રકાર જણાવો.

(બ) શેરોનો અર્થ વ્યાખ્યા અને અસરો જણાવો.

- 3 ચેકનો અર્થ સમજાવી તેના વિવિધ પ્રકારોની સમજૂતી આપો. 15

અથવા

પ્રોમિસરી નોટનો અર્થ અને તેનાં લક્ષણો વર્ણવો.

- 4 વિનિમયપત્ર (Bill of Exchange)નો અર્થ આપી તેના લક્ષણો વર્ણવો. 15

અથવા

- 4 ટૂંક નોંધ લખો : (કોઈ પણ ત્રણ) 15

(1) કોર બેંકિંગ

(2) ક્રેડિટ કાર્ડ

(3) એ.ટી.એમ.

(4) ડેબિટકાર્ડ

(5) ઓનલાઈન બેંકિંગ

ENGLISH VERSION

- Instructions :** (1) Give clear and to the point answers.
(2) Figures to the right side indicate marks.

- 1** After discussing necessity of Banking technology in modern times explain its importance. **20**

OR

Explain in detail about the guiding principles of safe lending.

- 2** Explain meaning and features of Negotiable Instrument Act. **20**

OR

- (a) State the types of crossings.
(b) State the meaning definition and effects of endorsement.

- 3** Give meaning of cheque. Discuss its types. **15**

OR

Describe the meaning and characteristics of promissory note.

- 4** Write short notes : (Any **Three**) **15**

- (1) Core banking.
(2) Credit Card.
(3) ATM
(4) Debit card
(5) Online Banking.